

## વીર બાળક અબ્દુલ અકબર

-પોપટલાલ મંડલી

દક્ષિણ ભારતની આ વાત છે. કેરળ નામના રાજ્યમાં તિરુરુચિ નામનું ગામ આવેલું છે. આ ગામના પાદરમાં થઈને ભરથપૂજા નામની નદી વહે છે. નદી ઊંડી છે. તેનો પ્રવાહ વેગીલો છે.

આમ છતાં આ નદીમાં અનેક માણસો સ્નાન કરવા આવે છે.

આ ગામમાં અબ્દુલ અકબર નામનો ચૌદ વરસનો વીર બાળક રહે. એને તરવાનો ભારે શોખ. એ દરરોજ નદીમાં કલાકો સુધી નહાય. નહાતાં નહાતાં તરતાં શીખે. થોડાં જ વરસોમાં એ સારો તરવૈયો બની ગયો. એનું શરીર માછલી જેવું ચપળ અને કૌવતવાળું બની ગયું. એ ઝડપથી તરી શકતો હતો. વળી તે ઊંડી ડૂબકી મારી શકતો હતો. એ જેવો તરવૈયો હતો તેવો જ બહાદુર અને પરમાર્થી હતો.

૩ એપ્રિલ ૧૯૭૫ નો એ દિવસ હતો. અબ્દુલ અકબર નદીમાં મોજથી નહાતો હતો. બીજાં ઘણાં માણસો નદીમાં નહાતાં હતાં. એમાં બે સ્ત્રીઓ પણ હતી.

આ સ્ત્રીઓએ પોતાનાં બે બાળકોને નદીના કાંઠે બેસાડ્યાં હતાં. બંને નદીની વાતોમાં મશગૂલ હતી. બાળકો પ્રતિ એમનું ધ્યાન ન હતું.

એવામાં પેલાં બે બાળકો બેસી બેસીને કંટાળ્યાં. તેઓ હવે રમવા લાગ્યાં. રમતાં રમતાં નદીમાં પડી ગયાં. કિનારાના લોકોએ ‘બચાવો બચાવો’ની બૂમો પાડી.

પેલી બે સ્ત્રીઓને ઘાસકો પડ્યો. એમણે હાંફળાં ફાંફળાં થતાં જોયું તો નદીમાં ડૂબતાં બાળકો પોતાનાં જ હતાં. કિનારા પરના માણસો પૈકી કોઈ એક પણ એમની વહારે ધાતું ન હતું.

બંને સ્ત્રીઓ ઝડપથી પોતાનાં ડૂબતાં છોકરાંઓ પાસે પહોંચી ગઈ. બંને બાળકો પોતપોતાની માને બાઝી પડ્યાં. પરંતુ આ શું ? પેલી સ્ત્રીઓ બાળકો સાથે ડૂબતી હતી. એમને તરતાં આવડતું ન હતું. બંને હવે ‘બચાવો બચાવો’ની બૂમો પાડવા લાગી.

આ બધો ખેલ જોતો અબ્દુલ અકબર પાસે જ નહાતો હતો. અબ્દુલને વિચાર આવ્યો, 'ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે જો આ બે સ્ત્રીઓ પોતાને પકડશે તો પાંચેયને નદીના તળિયે જતાં વાર નહિ લાગે.' પરંતુ આ વિચાર સ્વાર્થીલો અને કાયરનો ગણી કાઢી નાખ્યો.



અબ્દુલ અકબર ઝડપથી ડૂબતાં ચારેયની પાસે પહોંચી ગયો. એ ચારેને છૂટા પાડી એક પછી એકને કિનારે મૂકી આવ્યો. આ બચાવકામ એણે કલ્પનામાં પણ ન આવે એટલી ત્વરાથી કર્યું. ચાર જીવોનો બચાવ થવાથી કિનારે ઊભેલા લોકોએ અબ્દુલ અકબર પર ધન્યવાદની વર્ષા કરી.

અબ્દુલ અકબરના આ પરાક્રમનું વર્ણન દેશના બધા જ અગ્ર દૈનિકોમાં સારા સ્થાનોથી પ્રગટ થયું.

રાષ્ટ્રપતિએ ૨૬ મી જાન્યુઆરી , ૧૯૭૬ના રોજ અબ્દુલ અકબરને દિલ્લી બોલાવી બાલ-વીર પુરસ્કારથી નવાજ્યો. એનું આવું સન્માન થવાથી એનું ઘર-કુટુંબ અને ગામ દેશના નકશામાં ઉપસી આવ્યાં.

